

ત્વરિત જાહેરાત માટે

## રિજન ઓફ પીલના બ્રમ્પટન, મિસિસોગા અને કેલેડનનાં કરદાતાઓનાં શ્રેષ્ઠ હિતોના રક્ષણાર્થે બ્રમ્પટન કાઉન્સિલ મતદાન કરી રહી છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (22 મે 2019) – ગઈકાલે કાઉન્સિલની ખાસ સભામાં, બ્રમ્પટન સીટી કાઉન્સિલે સર્વસંમતિથી રિજન ઓફ પીલના વહીવટી ઉચ્ચ સ્તરના માળખા અને સીટી ઓફ બ્રમ્પટનની કાઉન્સિલના માળખાને જાળવી રાખવાની દરખાસ્ત પસાર કરી હતી. દરખાસ્તમાં ઠેરવવામાં આવ્યું:

*"કે બ્રમ્પટનના નાગરિકોના સમર્થનથી અને રિજન ઓફ પીલના કરદાતાઓના શ્રેષ્ઠ હિતોના રક્ષણ કાળે બ્રમ્પટન સીટી કાઉન્સિલ રિજન ઓફ પીલના વહીવટી ઉચ્ચ સ્તરના માળખા અને સીટી ઓફ બ્રમ્પટનની કાઉન્સિલના નિમ્ન સ્તરનાં માળખાને જાળવી રાખવા અનુમોદન આપે છે.  
કે સીટી ઓફ બ્રમ્પટન તે અનુસાર ગવર્નમેન્ટ ઓફ ઓન્ટારિયોને સૂચિત કરે."*

પીલ રિજનનાં કરદાતાઓને રક્ષણ આપવાનાં આ નિર્ણયને સ્પેશ્યલ એડવાયઝર્સ સમક્ષ રજૂ કરવામાં આવ્યો જેઓ પ્રાંતની પ્રાદેશિક સરકારોની સમીક્ષાનું નેતૃત્વ કરી રહ્યા છે.

કાઉન્સિલે ડેલોઈટ પાસેથી સ્વતંત્ર વિશ્લેષણ પ્રાપ્ત કર્યું છે જે સૂચિત કરે છે કે રિજન ઓફ પીલનું વિસર્જન કરવાથી બ્રમ્પટન, મિસિસોગા અને કેલેડનના કરદાતાઓએ વધુ કિંમત ચુકવવી પડશે.

અન્સ્ટર્ટ એન્ડ યંગ (E&Y) દ્વારા પણ વિત્તીય વિશ્લેષણ પૂરું પાડવામાં આવ્યું જે તમામ ત્રણ સમુદાયોમાં રહેલ પીલના કરદાતાઓ પર થનાર ઉંચી કિંમતના પ્રભાવની ખરાઈ કરે છે જે ઉચ્ચ સ્તરના વહીવટી પરિવર્તનોથી પરિણમી શકે.

બ્રમ્પટનની ટર્મ ઓફ કાઉન્સિલ પ્રાયોરિટિઝના વિસ્તરણ તરીકે સંપત્તિ અને સેવાઓના વહીવટ મારફત સુચારુ રીતે ચલાવવામાં આવતું શહેર આપવા માટે સીટી પ્રતિબદ્ધ છે કે તે બ્રમ્પટન નિવાસીઓને શ્રેષ્ઠ રીતે સેવાઓ પૂરી પાડવાની કાર્યક્ષમતાઓ શોધી કાઢે.

એપ્રિલ માસથી સીટીએ નિવાસીઓને અને અન્ય હિસ્સેદારોને પ્રાદેશિક વહીવટ માટેના ત્રણ વિકલ્પો અંગે સક્રિય રીતે પ્રવૃત્ત કર્યા છે:

- સ્ટેન્ડઅલોન સીટી બનવું (એટલેકે રિજનનું વિસર્જન કરવું)
- ત્રણ નગરપાલિકાઓને એક મોટા શહેરમાં વિલય કરી દેવી
- હાલના માળખાને અપરિવર્તિત રહેવા દેવું

આ વર્ષનાં પૂર્વાર્ધમાં ઓન્ટારિયો પ્રાંત દ્વારા પ્રાદેશિક સરકારોની સમીક્ષા કરવાનો પ્રારંભ થયો જેથી સુનિશ્ચિત કરી શકાય કે નગરપાલિકાઓ અને પ્રાદેશિક સરકારો સંભવ હોય એટલા અસરકારક રીતે કાર્ય કરી રહ્યા છે અને સમાજ જેના પર આધાર રાખી શકે એવી મહત્વની સેવાઓ આપવી ચાલુ રાખી શકે. પ્રાદેશિક વહીવટનો અંતિમ નિર્ણય પ્રોવિન્સ ઓફ ઓન્ટારિયોનો રહેશે જે 2019માં અપેક્ષિત છે.

### મુખ્ય મુદ્દાઓ

- ટેલિફોન ટાઉન હોલ, ટાઉન હોલ સભા, ઓનલાઇન સર્વેક્ષણ, ત્રીજા પક્ષ દ્વારા ઝીણવટપૂર્વક થયેલ વૈજ્ઞાનિક અધ્યયન અને સીટીની વેબસાઇટ પર ઓનલાઇન સંપર્ક સહિત સંખ્યાબંધ રીતે સીટીએ [સમુદાયને પ્રવૃત્ત કર્યાં](#).
- જાહેર જનતા પાસેથી મળેલી મોટા ભાગના સૂચનો [રિજન ઓફ પીલના હાલના માળખાને અકબંધ રાખવાની તરફેણમાં હતાં](#)
- રિજનમાંથી છૂટા પડવાની કિંમત, કોસ્ટ એન્ડ સર્વિસ ડિલિવરી અંગેની જનતાની સૌથી મહત્વપૂર્ણ ચિંતા તરીકે ટાંકવામાં આવી હતી
- મેઈનસ્ટ્રીટ રિસર્ચ દ્વારા જાહેર મતદાન કરીને શોધી કાઢવામાં આવ્યું કે લગભગ 10 પૈકી 7 નિવાસીઓ (66.4%) રિજન ઓફ પીલના વહીવટી માળખાના હાલનું ઉપલું સ્તર જાળવી રાખવાને સમર્થન આપે છે
- પ્રોવિન્સ ઓફ ઓન્ટારિયો મિનિસ્ટર ઓફ મ્યુનિસિપલ અફેર્સ એન્ડ હાઉસિંગ હસ્તે તેઓની પ્રસ્તાવિત ભલામણો જાહેર કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
- પ્રોવિન્સનાં સ્પેશ્યલ એડવાયઝરો મિનિસ્ટર ઓફ મ્યુનિસિપલ અફેર્સ એન્ડ હાઉસિંગને તેમની ભલામણો રજૂ કરે (2019ના ઉનાળાનો પૂર્વાર્ધ) ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે

### ક્વોટ

"કાઉન્સિલે સ્પષ્ટપણે જાણ્યું કે પ્રવર્તમાન પીલ રિજન અને સીટી કાઉન્સિલના વહીવટી માળખાં જેમના તેમ રાખવા તે નિવાસીઓનો પસંદગીનો વિકલ્પ હતો. જનતાની પ્રધાન ચિંતા યુક્તવવામાં આવે તે કિંમતની અનિશ્ચિતતા હતી અને અમે કરદાતાઓને રક્ષણ આપવા અને કાર્યક્ષમતાઓ શોધી કાઢવા પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય છે કે અમારી સેવાઓ સંભવ હોય એટલી સૌથી કાર્યક્ષમ રીતે પહોંચશે તેની ખાતરી કરવી. E&Y તેમજ ડેલોઈટ દ્વારા થયેલ બન્ને સ્વતંત્ર વિત્તીય વિશ્લેષણો સ્પષ્ટપણે દર્શાવે છે કે મિસિસોગા, બ્રમ્પટન અને કેલેડનમાં પ્રાદેશિક વિસર્જન અથવા વિલય કરદાતાઓને મોંઘું પડશે. પ્રોવિન્સને અમારી રજૂઆત તે છે કે રિજન ઓફ પીલને જેમ છે તેમ રાખો અને કરદાતાઓને અગ્રિમતા આપો."

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કરી છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવનિતા તરફ ઘેરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)